

2nd November, 2023

BSE Limited Listing Dept. / Dept. of Corporate Services, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001. National Stock Exchange of India Ltd. Listing Dept., Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G. Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051.

Security Code: 539301
Security ID: ARVSMART

Symbol : ARVSMART

Dear Sir / Madam,

Sub: Submission of newspaper advertisement in respect of financial results of the Company.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 2nd November, 2023 in the Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) in respect of the extract of the financial results of the Company for Q2 & H1 FY24.

The copy of the same will also be available on the website of the Company at https://www.arvindsmartspaces.com/investors/updates/.

You are requested to take the same on your record.

Thanking you,

Yours faithfully,

For Arvind SmartSpaces Limited

Prakash Makwana Company Secretary

Encl.: As above





IGL NET PROFIT JUMPS 29.5% IN Q2THIS FISCAL

INDRAPRASTHA GAS Ltd on Wednesday reported a jump of 29.5% in its consolidated net profit to ₹552.67 crore for the July-September quarter of the current financial year, as compared from ₹426.84 crore in the

REC PROFIT UP 39% AT ₹3,790 CR IN SEPT QUARTER

same period a year ago on

the back of rise in sales of

both CNG and PNG.

STATE-OWNED REC Ltd on Wednesday posted a nearly 39% rise in its consolidated net profit to ₹3,789.90 crore in the September quarter compared to the year-ago period mainly on the back of higher revenues. The net profit stood at ₹2,732.12 crore in the quarter ended on September 30, 2022.

FRESHWORKS NET LOSSES REDUCE IN Q3

NASDAQ-LISTED SaaS firm Freshworks saw a consolidated

revenue of \$153.6 million during the third quarter of 2023, a 19% increase on the same period last year. The company reported a Non-GAAP income from operations of \$17.4 million in Q3 2023, up from \$3.1 million in the corresponding period last year.

RATTANINDIA POWER Q2 NET LOSS WIDENS

RATANINDIA POWER on Wednesday said its consolidated net loss widened to ₹632.67 crore in the second quarter ended September 30, 2023. It had clocked ₹517.60 crore net loss in the comparable period in the corresponding fiscal, the company said in a regulatory filing.

SPICEJET GETS 5 LEASED BOEING 737 AIRCRAFT



NO-FRILLS AIRLINE SpiceJet, which is grappling with

financial and operational headwinds, on Wednesday said it has inducted five leased Boeing 737 planes into its fleet. This will help the airline launch new flight routes and services, the

airline added. FE BUREAU AND AGENCIES

SMARTSPACES

EXITS HIGHEST IN SEVEN QUARTERS

NEWS PE/VC investments soar 60% in Sept quarter: EY

Investments 5% lower than Q2

RAGHAVENDRA KAMATH Mumbai, November 1

PRIVATE EQUITY AND VEN-TURE capital (PE/VC) investments rose 60% on a YoY basis in Q32023 and touched \$13.6 billion, said consulting and audit firm EY India in its latest PE newsletter. However, they were 5% lower than O2 this year. The number of deals in Q3 was lower by 18% on YoY basis, it said.Apickup in pure-pay PE/VC investments of 88% bolstered the growth in total PE/VC investments in Q32023, which recorded 31 large deals, aggregating \$10.7 billion, compared to 15 large deals worth \$4.8 bil-

lion in Q3, 2022, it said. Growth investments were the highest in Q3, 2023, at \$4.5 billion, followed by buyouts at \$3.5 billion. From a sector point of view, infrastructure was the top sector in Q3, 2023, at \$3.9 billion.PE/VC exits were at \$8.6 billion across 85 deals in Q3, 2023, highest in seven quarters. Open market exits accounted for 44% of all exits by value. "Strong returns generated by PE funds in recent exits are adding to the attractiveness of the sector for PE/VC funds," it said.


"Looking at the strong deal pipeline, notwithstanding the increasingly uncertain global macro, we remain hopeful that Indian PE/VC investments in 2023 will surpass 2022 levels," said Vivek Soni, partner and national leader of private equity services at EY India.

PE fund managers also say

A SNAPSHOT

■ PE/VC investments are up 60% on a y-o-y basis in Q3 and touched

\$13.6 bn ■ PE/VC investments are 5% lower than Q2



■ Growth investments were the highest in Q3 at \$4.5 billion, followed by buyouts at

■ PE/VC

investments rising. "Since late last year, we are seeing a strong sequential improvement in PE/VC investments in India. From a five-year perspective, there has been an definite improvement in PE/VC investments in India," said Ankit Aggarwal, director, Kotak Private Equity at Kotak Alternate Asset Managers. Aggarwal said the increase in PE deployment is due to the Indian government's focus to create a growth-oriented mindset and consistent regulatory and policy environment. Given the record amount of capital that has been raised by India-focused funds, there is substantial capital waiting to be deployed, Aggarwal said, adding that by end of 2021, total PE/VC

The

number of

deals in Q3

was lower

by **18% on**

y-o-y basis

lion was raised by funds. Renuka Ramanathan, managing director and CEO at Multiples Asset Management, said that "confidence in the Indian alternate investment space is

dry powder was \$11.1 billion

and in 2022, further \$13.7 bil-

\$3.5 billion Source: EY India decades." India is set to witness a huge flow of alternate capital for building AtmaNirbhar Bharat led by atma vishwas (self confidence) of business builders and investors," she said. "We are creating valuable companies that can address global opportunities, through digital prowess and innovations; Second, consolidation of Indian corporates to become mega corporates thereby becoming globally competitive," she added. Thirdly, capital restructuring by strong profitable companies, taking advantage of the avail-

Akhil Awasthi, managing partner, Tata Capital Growth Fund said that their sources suggest that the deals in the July-September quarter of 2023 are much higher than what the Refinitiv figure suggested.PE investments in the September

ability of equity through alter-

native assets in bringing trans-

formative changes and building

sustainable future-proof com-

\$8.3 billion, compared to \$5.2 billion in the same period a year back. Even after taking out the big-ticket deals in Reliance Retail, the GIC investment of \$1.5 billion in Genus Power, it would be around the \$5.2-5.3 billion mark in Q3 CY 2023 (similar amount to the Q3 CY 2022), he said. Going forward, he sees PE deals gaining momentum in the next three months of 2023 and 2024.

"On the macro side India is an attractive investment destination given its potential growth, macroeconomic and policy stability. At a micro level there are still good companies and entrepreneurs who prefer to raise capital from PE to scale up businesses with an aim to IPO the company," he said.

However, investors may turn cautious if the existing geo-political tension in West Asia flares up resulting in spike in crude prices which can have an adverse impact on the US dollar Indian rupee exchange rates, he said.

Pranav Parikh, Managing partner & Head PE, Nuvama Asset Management expects that the space would continue to see activity build up over the next few quarters. "Business activity and capex cycles are seeing very high momentum on basis of various macro tail winds. There is significant dry powder available for deployment in any case," Parikh said. He said that there is also heightened interest in large M&A deals where funds are partnering with corporates and that is a clear sign of maturity of the PE ecosystem in this country. "This will lead to large deals

in the market," he said. the highest in the last two quarter of 2023 was around Mumbai climbs to fourth rank in prime residential prices index


FE BUREAU Mumbai, November 1

MUMBAI MOVED UP 18 places to reach the fourth-highest position in terms of y-o-y increase in prime residential prices in Prime Global Cities Index Q3 of 2023 of Knight Frank. It was at the twenty sec-

ond rank in Q3 2022. New Delhi and Bengaluru too recorded also moved up. Delhi moved from the thirty sixth rank in Q3 2022 to tenth in Q3 2023, with a growth of 4.1% y-o-y. Bengaluru's went from twenty seventh place in Q3 2022 to seventeenth in Q3

2023 with a y-o-y rise of 2.2%. The average rise in annual prime residential prices was recorded at 2.1% across the 46 markets in the 12-month period ending September 2023.

RISING UP



recorded since Q3 2022 and reflects 67% of cities seeing

Shishir Baijal, chairman and managing director at Knight Frank India, said, "The

robust price trend in the upper end of the market, coupled with a strong sales momentum, has elevated Mumbai's position in this global ranking scale. Sales momentum is significantly stronger in the higher ticket sizes today than it has been in the past five years. The homebuyers' increasing need to upgrade their lifestyle, coupled with stable economic prospects of the country and improving market sentiments should sustain price growth in the short to medium term."

Manila claimed the top spot in the ranking, with a 21.2% annual rise in prices. Dubai, with its 15.9% annual growth, has been displaced from the top position for the first time in eight quarters due to a sharp decline in quarterly growth from 11.6% in Q2 to 0.7% in Q3.

This is the strongest growth rate growth on an annual basis.

ARVIND SMARTSPACES LIMITED [CIN - L45201GJ2008PLC055771]

Regd. Office: 24, Government Servant's Society, Near Municipal Market, Off. C.G. Road, Navrangpura, Ahmedabad-380009. Contact: 079 6826 7000 Website: www.arvindsmartspaces.com Email: investor@arvindinfra.com

EXTERACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2023

						[₹ in Lakhs exce		
Sr.	Particulars	Quarter ended on			Half year ended on		Year ended	
No.		30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
1	Revenue from Operations	7266.92	6683.61	5,033.93	13950.53	11,060.11	25591.68	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1588.78	1309.11	779.12	2897.89	1,812.89	3957.71	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1588.78	1309.11	779.12	2897.89	1,812.89	3957.71	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1083.17	910.04	489.29	1993.21	1,228.60	2782.71	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1078.92	905.79	489.59	1984.71	1229.18	2765.70	
6	Equity Share Capital (Face Value ₹ 10/- per share)	4531.20	4531.20	4,396.21	4531.20	4,396.21	4531.20	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	42109.97	
8	Earnings Per Share (of ₹ 10/- each) Basic : (₹)	1.91	1.77	1.13	3.68	2.83	5.83	
	Diluted: (₹)	1.89	1.76	1.10	3.65	2.78	5.63	

Notes: (1) These unaudited consolidated financial results of Arvind SmartSpaces Limited ("Holding Company") and its subsidiaries (together referred as "Group") and joint ventures for the quarter and half year ended 30th September, 2023 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on 1st November, 2023. The consolidated financial results are prepared in accordance with the Indian Accounting Standard (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013. (2) The Group's business falls within single business segment of developing of commercial and residential units. Hence, disclosures under Ind AS 108- Operating Segments are not reported separately. (3) Previous period figures have been regrouped, rearranged and reclassified where

The standalone financial results for the quarter and half year ended 30th September, 2023 are summarised below: [₹ in Lakhs] Quarter ended on Half year ended on Year ended No. 31.03.2023 30.06.2023 30.09.2023 30.09.2022 30.09.2023 30.09.2022 Audited Unaudited Unaudited Unaudited Unaudited Unaudited 4269.64 3233.53 2875.03 7503.17 5645.23 11727.81 **Revenue from operations** 2328.12 1479.32 1299.38 3807.44 2768.69 4734.41 2 **Profit before tax** 2105.80 1221.03 1043.30 3326.83 2232.43 3827.31 Profit after tax

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the standalone and consolidated financial results are available on the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com and on the company's website www.arvindsmartspaces.com.

Date: 1st November, 2023

necessary to conform to current period's classification.

For, Arvind SmartSpaces Limited Kamal Singal Managing Director and CEO

TCPL eyes ₹1,000-crore topline from NourishCo

VIVEAT SUSAN PINTO Mumbai, November 1

THE FAST-MOVING CON-**SUMER** goods (FMCG) arm of the Tata group — Tata Consumer Products — is aiming for a turnover of ₹1,000 crore in the current financial year (FY24) from the NourishCo portfolio. The latter, which includes brands such as Himalayan packaged water, Tata Gluco Plus and Tata Copper Plus, closed FY23 with net sales of ₹621 crore, a growth of

80% versus the previous year. The ₹1,000-crore topline target for FY24 for NourishCo implies a growth of 61% versus FY23, which the company said would be achieved on the back of new launches and a distribution push across markets this year.

THREE SUBSIDIARIES TO MERGE

■ Tata Consumer Products would be merging NourishCo, which is a wholly-owned subsidiary, with Tata SmartFoodz and Tata Consumer Soulfull

■ This aims to ensure effective utilisation of resources and reduce compliance requirements

"We now reach around 650,000 outlets via NourishCo. While the business is growing in double digits, we still have a huge runway for growth. The key focus would be on scaling up both the portfolio as well as undertaking distribution expansion," Sunil D'Souza, MD & CEO, Tata Consumer Products, said during the company's latest analysts call, held on Wednesday.

D'Souza also said that Tata

Consumer Products would be merging NourishCo, which is a wholly-owned subsidiary, along with Tata SmartFoodz and Tata Consumer Soulfull into it, to ensure effective utilisation of resources and reduce compliance requirements. The scheme of amalgamation was subject to necessary statutory and regulatory approval including sanction from the National Company Law Tribunal, he added.

Ambuja Cement Q2 profit rises nine-fold to ₹793 cr

RAJESH KURUP Mumbai, November 1

AMBUJA CEMENTS, ADANI Group's cement and building materials firm, has posted a quantum leap in consolidated net profit at ₹793 crore for the quarter ended September 30, buoyant on a higher income and lower expenses. The net profit, which rose nearly nine times from ₹93.18 crore posted in the year-ago quarter, also beat street estimates.

A consensus estimate of Bloomberg analysts was expecting the firm to post a net profit of ₹616 crore.

During the quarter under review, the company's revenue rose 4.1% to ₹7,424 crore from ₹7,131 crore, while Ebitda rose 298.4% to ₹1,302 crore from ₹327 crore recorded in the same quarter of previous fiscal, it said in a statement.

Ajay Kapur, Whole Time Director & CEO, Ambuja Cements said: "Along with a strong demand for our premium cement products, our business performance improved due to operational excellence, supply chain management and sales and marketing excellence".

REPORT CARD

Ambuja Cements (consolidated financials) (₹ cr) **Q2FY23** Q2FY24 % change Revenue Ebitda Net profit

7,131 ☆ 751 298.4 ♠ 4.1 Ebitda Net profit margin (%) 4.6

Adjacencies with group companies is lowering input costs, in turn boosting Ebitda and margin growth, he added. Ambuja Cements' clinker

17.5

10.7

and cement sales volume grew 2.3% on a year-on-year basis, while kiln fuel cost fell by 34%, helped by operational efficiencies. On the outlook, the com-

pany expects the industry to witness volumetric growth as the demand environment remains robust.

Hit from oil biz: Adani Wilmar logs ₹131-cr loss

EDIBLE OIL MAJOR Adani Wilmar on Wednesday reported a consolidated net loss of ₹130.73 crore for the September 2023 quarter, as profitability was badly impacted in the cooking oil business.

The company, which sells edible oil and other food products under the Fortune brand, had posted anet profit of ₹48.76 crore in the year-ago period. Its total income also fell

to ₹12,331.20 crore during the July-September period of 2023-24 from ₹14,209.20 crore in the corresponding period of the previous fiscal, according to a regulatory filing.

The total expenses of Adani Wilmar stood at ₹12,439.45 crore during the second quarter of this fiscal.

Sun Pharma Q2 profit up 5%

SUN PHARMACEUTICAL INDUSTRIES on Wednesday said its consolidated net profit increased by 5% to ₹2,375 crore for the second quarter ended September 30, driven by robust sales across domestic and US markets.

The drug major had reported a net profit of ₹2,262 crore in the July-September period of last fiscal. Total revenue from operations increased to ₹12,192 crore in the second quarter this fiscal, as compared to ₹10,952 crore in the year-ago period, Sun Pharma said in a regulatory filing. Sun Pharma managing director Dilip Shanghvi noted that the US FDA's acceptance of deuruxolitinib NDA for treatment of moderate to severe alopecia areata marked an important milestone for the company.

"There are limited treatment options for alopecia areata and deuruxolitinib should make a meaningful difference in patient lives, once approved," he added. Similarly, another late stage candidate Nidlegy will potentially complement the company's Odomzo franchise, Shanghvi said.

Shares of Sun Pharmaceutical Industries on Wednesday climbed over 2.5% after the company reported its quarterly results.

India Cements pares Q2 losses to ₹81 cr

INDIA CEMENTS on Wednesday reported a lower net loss of ₹81 crore for the second quarter of FY24, as compared to loss of ₹138 crore in the corresponding quarter of last fiscal, on the back of substantial reduction in the variable cost on account of lower fuel prices. Total income of the company was almost flat at ₹1,228 crore as compared to ₹1,258 crore.

The performance of the company was better than that of the earlier quarters, despite the restricted operations caused by the stressed working capital position, even though the varying vintage of the production plants contributed to lower reduction of cost, as compared to the peers in the industry.

— FE BUREAU

Surge in DailyRounds revenue and profits BENGALURU-BASED HEALTHCARE

learning platform, DailRounds, posted a profit after tax (PAT) of ₹281 crore on a revenue of ₹515 crore in FY23, marking a growth of 42.1% in PAT and 28.1% in revenue over the previous year. It's total expenditure increased 11.4% to ₹188 crore in FY23. The company's employee benefits accounted for a significant 34% of the overall expenditure.

The company's Roce and Ebitda growth stood at 43% and 69%, respectively. The company's flagship product, Marrow, a learning platform for doctors, medical students formed 90% of the operating revenue generated by the firm in FY23 at ₹461 crore, rising 27.8% from ₹361 crore it generated in FY22.

— FE BUREAU

ED attaches assets worth ₹538 cr of Jet founder Goyal

PRESS TRUST OF INDIA New Delhi, November 1

The Enforcement Directorate

(ED) on Wednesday said it has attached assets worth ₹538 crore of Jet Airways founder Naresh Goyal, his family members and companies, in London, Dubai and India, as part of a money laundering investigation linked to an alleged bank loan fraud.

part of a money laundering probe, are in London, Dubai and India

The assets, attached as


The attached properties include 17 residential flats, bungalows and commercial premises. Located in London, Dubai and various cities in India, these properties are in

nies like Jetair Private Limited and Jet Enterprises Private Limited, Goyal, his wife Anita, and son Nivaan, the federal agency said in a statement. Goyal, 74, was arrested by

the name of various compa-

the ED on September 1 and the agency filed a charge sheet against him on Tuesday before a special Prevention of Money Laundering Act (PMLA) court in Mumbai.

Ahmedabad



KERALA WATER AUTHORITY e-Tender Notice

Tender No : T No.114 to 118/2023-24/SE/Q

JJM Chithara, Mylamoodu, Kulathuppuzha- Replacement of transmission main construction of WTP, construction of pump house pumping main and allied works EMD: Rs. 200000, 500000, Tender fee: Rs. 16540+2978, 11026+1985(18% GST), Last Date for submitting Tender: 29-11-2023 02:00:pm, Phone: 04742745293 Website: www.kwa.kerala.gov.in, www.etenders.kerala.gov.in

KWA-JB-GL-6-1487-2023-24 PH Circle Kollan

📭SBl ભારતીય સ્ટેટ બેંક

એસેટ મેનેજમેન્ટ શાખા : બીજો માળ, પરમસિધ્ધી કોમ્પલેક્ષ, વી. એસ. હોસ્પિટલ સામે અમદાવાદ - ૩૮૦૦૦૬, ● ફોન : ૦૭૯-૨૬૫૮૧૦૮૧/૧૨૦૬, ● ฮ์भेต : sbi.04199@sbi.co.in

પઝેશન નોટીસ

આથી, નીચે સહી કરનાર <mark>ભારતીચ સ્ટેટ બેંક ના</mark> અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ડીમાન્ડ નોટીસ હેઠળ તા. ૨૧.૧૧.૨૦૨૨ ના રોજ (બેંકે તા. ૨૦.૧૨.૨૦૨૨ ના રોજ ફાઈનાન્સિયલ એકસપ્રેસ (અંગ્રેજી + ગુજરાતી) ઓલ ગુજરાત કોમ્બોમાં ડીમાન્ડ નોટીસ પ્રકાશીત કરી હતી) માંગણા નોટીસ જારી કરીને ઉધારકર્તા **મે**. માર્ગો પ્લાચવુડ પ્રાઈવેટ લિમીટેડ, ઉધારકર્તા / ડાયરેક્ટર / જામીનદાર / મોર્ગેજર : (૧). શ્રી સંદિપકુમાર પુરણચંદ ગુપ્તા (૨). શ્રી અજય પુરણચંદ ગુપ્તા, (૩). શ્રીમતી ક્રિતીકા સંદિપ ગુપ્તા, (૪). શ્રીમતી નિલમ અજય ગુપ્તા ની ડીમાન્ડ નોટીસમાં જણાવેલ તા. ૧૮.૧૧.૨૦૨૨ સુધીની બાકી રકમ રૂા. ૧૮,૨૨,૫૩,૪૫૧.૩૮ (રૂા. અઢાર કરોડ બાવીસ લાખ ત્રેપન હજાર ચારસો એકાવન અને આડગીસ પૈસા પુરા) અને પછીનું ચડત વ્યાજ, આકસ્મિક ખર્ચાઓ વગેરે સાથે આ નોટીસ મળ્યાની તારીખથી ૮૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું.

ઉધારકર્તા ને ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં ઉધારકર્તા / ડાયરેકટર / જામીનદાર મોર્ગેજર તમો તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે ઉકત અધિનિયમની કલમ-૧ ૩ ની પેટા કલમ (૪) હેઠળ ના નિયમ - ૮ સાથે મળેલ સત્તાની 3એ બેંકના અધિકત અધિકારીએ નીચે જણાવેલ મિલકતોનો તા. ૩૧.૧૦.૨૦૨૩ ના રોજ પ્રત્યક્ષ કંબજો લઈ લીધેલ છે.

ઉધારકર્તા / ડાયરેક્ટર / જામીનદાર / મોર્ગેજર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ મિલકતો અંગે કોઈ સોદો કરવો નહી અને આ મિલકતો અંગે કોઈ પણ સોદો કરશે તો આ ભારતીય સ્ટેટ બેંક ની તા. ૧૮.૧૧.૨૦૨૨ સધીની બાકી રકમ 3ા. ૧૮.૨૨.૫૩.૪૫૧.૩૮ (3ા. અઢાર કરોડ બાવીસ લાખ ગ્રેપન હજાર ચારસો એકાવન અને આડગ્રીસ પૈસા પરા) અને ચડત વ્યાજ, આકસ્મિક ખર્ચાઓ વગેરે થયેલ રીકવરી જો હોય તો બાદ કરીને સાથે બોજાને આધિન રહેશે. "સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉધારકર્તાઓનું મુકરર

મિલકત છોડાવવા માટે મળવ	ા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.'
	ગિરવે મુકેલ મિલકતોનું વર્ણન

માલિક ૧. તમામ ભાગ અને હિસ્સા સાથેની બીન ખેતીલાયક જમીન (ઈન્ડસ્ટ્રીયલ), રેવન્યુ માર્ગો સર્વે નં. ૧૫/૧ પૈકી, પ્લોટ નં. ૧, ક્ષેત્રફળ ૯૮૪.૭૧ સ્કે.મી. અને પ્લોટ નં. ૨, લાચવુક ક્ષેત્રફળ ૬૦૬.૦૦ સ્કે. મી., એરીયાનું કુલ ક્ષેત્રફળ ૧૫૯૦.૭૧ સ્કે.મી., ગામ લિમીટેડ ભચાઉ, તાલુકો - ભચાઉ, કચ્છ. **ચતુઃસીમા ઃ- પ્લોટ નં. ૧ ઃ- પૂર્વૅ ઃ** આંતરીક માર્ગ ૭.૫૦ મી. અને તે પછી સમાન લેઆઉટ પ્લાન મુજબનો પ્લોટ નં. ૨, પશ્ચિમે **દ.૦૦ મીટરનો પેરીફેરી માર્જીન અને ત્યાર બાદ બાજુની જમીનનો સર્વે નં. ૧પ/ર** ઉત્તર : ૬.૦૦ મીટરનો પેરીફેરી માર્જીન અને ત્યાર બાદ બાજુની જમીનનો સર્વે નં. ૧૯/૧, દક્ષિણે : ૭.૫૦ મી. નો આંતરીક રોડ અને પછીનો કોમન પ્લોટ.

ચતુઃસીમાઃ- **પ્લોટ નં. ૨ઃ- પૂર્વે**ઃ ૬.૦ મી. નો આંતરીક રોડ અને જોડેની જમીન પછી સર્વે નં. ૧૫/૩, **પશ્ચિમે**ં ૭.૫૦ મી. આંતરીક રોડ અને પછીનો સમાન લેઆઉટ પ્લાન મુજબનો પ્લોટ નં. ૧, ઉત્તર ∶ ૬.૦૦ મી. પેરીફેરી માર્જીન પછી જોડેની જમીનનો સર્વે નં. ૧૯/૧, **દક્ષિણે** : ૭.૫૦ મી. નો આંતરીક રોડ અને પછીનો

૨. તમામ ભાગ અને હિસ્સા સાથેની બીન ખેતીલાયક જમીન (ઈન્ડસ્ટ્રીયલ), રેવન્યુ સર્વે નં. ૧૫/૨, એરીયા એકરનું ૦૨-૩૪ ગુઠાં, ૧૧૫૩૪ સ્કે.મી., ગામ - ભચાઉ, તાલુકો - ભચાઉ - કચ્છ. **ચતુઃસીમા**ઃ- **પૂર્વે**ઃ બીન ખેતીલાયક જમીનનો રેવન્યુ સર્વે નં. ૧૫/૧, પશ્ચિમે : નેશનલ હાઈવે અને જુનો રેલ્વે રોડ, ઉત્તરે : રેવન્યુ સર્વે નં. ૧૯/૨, દક્ષિણે : રેવન્યુ સર્વે નં. ૧૫/૩.

માર્ગો પ્લાયવુડ પ્રાઈલેટ લિમીટેડ ની માલીકીની જંગમ મિલકતનો પ્લાન્ટ અને માર્ગો મશીનરી, ફેક્ટરીની જગ્યાઓમાં તમામ ભાગ અને હિસ્સા સાથેની બીન ખેતીલાયક પ્લાચવુક જમીન (ઈન્ડસ્ટ્રીયલ), રેવન્યુ સર્વે નં. ૧૫/૨, એરીયા એકરનું ૦૨-૩૪ ગુઠાં, લિમીટેક ૧૧૫૩૪ સ્કે.મી., ગામ - ભચાઉ, તાલુકો - ભચાઉ - કચ્છ, તમામ ભાગ અને હિસ્સા સાથેની બીન ખેતીલાયક જમીન (ઈન્ડસ્ટ્રીયલ), રેવન્યુ સર્વે નં. ૧૫/૧ પૈકી, પ્લોટ નં. ૧, ક્ષેત્રફળ ૯૮૪.૭૧ સ્કે.મી. અને પ્લોટ નં. ૨, ક્ષેત્રફળ ૬૦૬.૦૦ સ્કે.મી. કુલ એરીયાનું ક્ષેત્રફળ ૧૫૯૦.૭૧ સ્કે.મી., ગામ - ભયાઉ, તાલુકો - ભચાઉ, કચ્છ.

તારીખ : ૩૧.૧૦.૨૦૨૩ સ્થળ : ભચાઉ

Registered Off

(વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી

અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક

adani wilmar

ADANI WILMAR LIMITED

Ahmedabad - 380 009, **CIN**: L15146GJ1999PLC035320, **Phone**: 079-26455650; **Fax**: 079-26455621; **Email**: investor.relations@adaniwilmar.in Website: www.adaniwilmar.com

Extract of Consolidated Financial Results for the

Quarter and Half year ended September 30, 2023

TPNØDL

(A Tata power and Odisha Govt. Joint Venture) Regd. Off: Corp Office, Januganj, Remuna Golei, Balasore, Odisha-756019

CIN No.: U40106OR2021SGC035951; Website: www.tpnodl.com

NOTICE INVITING TENDER (NIT) November 2nd, 2023 TP Northern Odisha Distribution Limited invites tender from eligible Bidders for the following:

Tender Enquiry No. **Work Description** 1 | TPNODL/OT/2023-24/2500000502 | Rate Contract for SITC of Rooftop solar at TPNODL Offices 2 TPNODL/OT/2023-24/2500000507 Supply & Installation of Citrix License

*MSMEs registered in the State of Odisha shall pay tender fee of Rs. 1,180/- including GST. ** EMD is exempted for MSMEs registered in the State of Odisha

PH Circle

For more details like bid due date, EMD, tender fee, bid opening date etc. of the Tenders, please visit "Tender" section TPNODL website **https://tpnodl.com**. All tenders will be available on TPNODL website. Future communication / corrigendum to tender documents, if any, shall be available on website

Chief- Contracts & MM

GUJARAT ENERGY TRANSMISSION CORPORATION LTD. Regd. Office: Sardar Patel Vidyut Bhavan, Race Course, Vadodara (Gujarat): 390007

GETCO: www.getcogujarat.com Dept- https://www.nprocure.com

Tender Notice No. CE (P&C) : TN-16 : 23-24

[A] Procurement : (1) Numerical Relay (2) PLCC Exchange (3) G.I Earth-wire (4) Silicon Rubber Insulators (5) ACSR & AL-59 Conductor

[B] Civil: CE(P&C)/ Contracts/ Civil/ 181,227,228,229,230,231,233 & 233/23-24/ ARC Corporate Office, ARC Pile Foundation, 220 kV Shelavadar & Mesanka, 220 kV Palitana Otha Savarkundala, 66 kV Akoli s/s, Limbdi Admin Buildng, 66 kV Gujarwadi s/s & 66 kV Bhirandiyara.

Construction of Control Room Building, Foundations, Cable Trench, C'Wall, RCC Road & Misc. civil works at (1) ARC Corporate Office, (2) ARC Pile Foundation under Navsari Circle, (3) 220 kv Mesanka & Shelavadar, 220 kV Palitana s/s, Otha & Savarkundla s/s under Amreli TR Circle (4) 66 kV Akoli s/s under Palanpur TR Circle (5) Limbdi Admin Building at 220 kV Limbdi s/s & 66 kV Gujarvadi under Surendranagar TR Circle (5) 66 kV Bhirandiyara s/s under Anjar TR Circle [C] EPC: CE(P&C)/Contracts E-167/TL/400 kV/S&E : EPC of 400 kV D/C Kalawad-

Saurashtra (765 kV) Line Package -1 (74.00 km) & Package-2 (74.7 km) Above Tender are available on web-site www.getcoguiarat.com (for view and

download only) & https://getco.nprocure.com & getcotender.nprocure.com (For view, download and on line tender submission)

Note: Bidders are requested to be in touch with our website till opening of the Tender Dated 01/11/2023 Chief Engineer (Procurement & Contracts)

KERALA WATER AUTHORITY e-Tender Notice

ender No: T No.102 to 108/2023-24/SE/Q

JJM Ittiva, Veliyam, Pattazhy Vadakkekkara, Edamulakkal, Poruvazhy, Sooranad North, Piravanthoor- construction of OHSR, pipe line extension and allied works EMD: Rs. 200000, 500000, Tender fee: Rs. 11026+1985, 16540+2978, (18% GST), Last Date for submitting Tender: 29-11-2023 02:00:pm, Phone: 0474 745293, Website: www.kwa.kerala.gov.in, www.etenders.kerala.gov.in

KWA-JB-GL-6-1482-2023-24



રીજનલ ઓફિસ, લાલ દરવાજા, અમદાવાદ - ૩૮૦ ૦૦૧

<u> પરિશિષ્ટ -</u> ૪ (નિયમ-૮(૧)) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી, નીચે સહી કરનાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, વાસણા શાખા, જીક્ષો અમદાવાદન અધિકૃત અધિકારીને સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ऑફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એર્ન્કોસમેન્ટ ઑક સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ અને કલમ ૧૩(૧૨) ઠેઠળ મળેલ સંત્તા સાથે સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ના નિયમ, ૨૦૦૨ સાથે વંચાતા નિયમ ૩ અંતર્ગત તા ૦૨.૦૫.૨૦૨૨ ના રોજ જારી કરેલ ડિમાન્ડ નોટીસ હ્રારા કરજદાર **મેસર્સ કે રીતેષ કુમાર, શ્રી** રિતેષકુમાર મોહનલાલ મોટવાણી (પ્રોપરાઈટર), શ્રી મોહનદાસ તીચુમલ મોટવાણી **(ગીરોદાર/જામીનદાર)** ને નોટીસમાં જણાવેલી રકમ રૂા. ૧,૩૫,૬૯,૮૪૩/- (રૂા. એક કરોડ પાંત્રીસ લાખ ઓગણસિત્તેર હજાર આઠસો તેત્તાળીસ માત્ર) સાથે કથિત નોટીસ મળ્યા તારીખથી ૬૦

દિવસમાં ચૂકવવા જણાવવામાં આવ્યુ હતું. કરજદાર/જામીનદાર આ રકમ ચુકવવામાં અસફળ રહ્યા હતા જેથી કરજદાર/જામીનદાર અને જાહેર જનતાને નોટિસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ એર્ન્ફોસમેન્ટ નેચમ ૨૦૦૨ ના કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૪) સાથે વાંચતા નિચમ ૮ हેઠળ મળેલ સત્તાર્ન રૂએ **તા. ૨૮.૧૦.૨૦૨૩** ના રોજ નીચે જણાવેલ મિલકતનો પ્રત્યક્ષ કબજો લઈ લીધેલ છે.

આથી કરજદાર/ભાગીદાર/જામીનદારો/ગીરેદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામ આવે છે કે નીચે દર્શાવેલ મિલકત માટે કોઈ પણ વ્યવહાર કરવો નહિં અને જો કોઈ પણ વ્યવહાર કરશો તો **સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની બાકી રકમ** રૂા. ૧,૩૫,૬૯,૮૪૩/- (રૂા. એક કરોડ પાંત્રીસ લાખ બોગણસિત્તેર હજાર આઠસો તેત્તાળીસ માત્ર) તા. ૦૯.૧૨.૨૦૨૨ થી ચડત વ્યાજ અને ખર્ચા **સાથે**

'સદરહુ કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે કરજદારનું મુકરર મિલકત છોકાવવા માટે મળવાપાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.''

સ્થાવર મિલકતનું વર્ણન

ઈક્વિટેબલ ગીરો મિલકત જમીન પ્લોટ અને રહેણાંક ટેનામેન્ટ ઘર જે મોદનદાસ તેયુમલ મોટવાણીની માલીકી ટેનામેન્ટ નં. ૨૨, તેનો પ્લોટ એરિયા ક્ષેત્રફળ ૧૦૦ સ્કે. મીટર્સ (૧૦૮.૫૬ મીટર્સ સીટી સર્વે મિલકત રૂલસ કાર્કસ), ગોપાલ પાર્ક કો-ઓપ હાઉસીંગ સોસાયટી, બાંધકામ અને ફ્રી ફોલ્ડ બીનખેતી જમીન સીટી સર્વે નં. ૧૯૭૫/બી/૧૨ મોજે વોર્ડઃ (સરદારનગર) રજીસ્ટ્રેશન જીલો સબ જીલો અમદાવાદ . ૬ (નોરાડ), તાલુકા સીટી (પૂર્વ) અમદાવાદ ગુજરાત રાજ્ય. ચતુરસીમાઃ પૂર્વેઃ ઘર નં. ૨૧, પશ્ચિમઃ ઘર નં. ૨૩, ઉત્તરઃ એપ્રોચ રોડ, દક્ષિણઃ માર્જીન જગ્યા.

તારીખ : ૨૮.૧૦.૨૦૨૩ સ્થળ : અમદાવાદ

(₹in Crores)

સહી/- અધિકૃત અધિકારી સેન્દ્રલ બેંક ઓફ ઈન્ડિયા



૨જી. ઓફિસઃ ૫૦૪, નિર્મલ એકસ્ટસી, પાંચમા માળ, જટાશંકર ડોસા રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ ૪૦૦ ૦૮૦ **શાખા ઓફિસઃ** એ-૨૦૨, ગણેશ પ્લાઝા, નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે,નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯. ફોન નં. : ૦૭૯-૨૬૪૪૯૯૧૮

આથી, ઈન્ડીયા હોમ લોન લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફેસી કાયદો) ના વચાણે લેતા કલમ ૧૩ (૧૨) તથા નિયમ ૩ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ના અન્વયે ઋણકત સહ- ૠણકર્તા/ગેરેન્ટર્સ/મોર્ગેઝર જે નીચે જણાવેલ છે તેઓને ડિમાન્ડ નોટીસો આપેલ હતી જે અનુસાર બેંકની કુલ લેણી રકમ વગેરે ચુકવવા જણાવવામાં આવ્યુ હતું. ઋણકર્તા સહ ઋણકર્તા/ગેરેન્ટર્સ/મોર્ગેઝર રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી ખાસ ઋણકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ મિલકતનો સેક્શન ૧૩(૪) તથા નિયમ ૮ હેઠળ મળેલી સત્તાની રૂએ **તા.૨૩-૦૯-૨૦૨૩ ના રોજ મિલકતનો પ્રત્યક્ષ કબજો મેળવી લીઘેલ છે.** ઋણકર્તા સહ ઋણકર્તા/ગેરેન્ટર્સ/મોર્ગેઝરને ખાસ અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકત સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર તે મિલકત અંગેનો ઈન્ડીયા હોમ લોન લીમીટેડ અને તેની પર ચડતા વ્યાજ અને અન્ય ખર્ચા વગેરેના બોજાને આધિન રહેશે. ૠણકર્તા સહ-ૠણકર્તા/ગેરેન્ટર્સ/મોર્ગેઝરને સરફેસી એક્ટની અને નિયમોની જોગવાઈઓ અનુસાર સુરક્ષિત મિલકતોને છોડાવવા માટેપ્રાપ્ત થતા સમય અંગે ધ્યાન દોરવામાં આવે છે.

લોન એકાઉન્ટ નં. ઋણકર્તા સહ-ૠણકર્તાના નામ	ਅਗਮ ਰ ਤਿੰ ਮਰ	અર્નેસ્ટ મની ડિપોઝીટ	ઈ-ઓક્શન તારીખ અને ઈએમડીની છેલ્લી તારીખ	પ્રકાર કલ્લાનો	સ્થાવર મિલકતની વિગતો
AMD2207 શ્રી જચરાજ અશોક્કુમાર સુરતી/ શ્રીમતી મીનાબેન અશોક્કુમાર સુરતી	3018661/-	3,01,४८૯/-	२3.११.२०२3		બ્લોક નં. એ, ફલેટ નં. પ૦૧, પાંચમા માળે, પરિવાર હોમ્સ, દેવનગર ગામ સામે, સેવેન્થ પરિસર પાસે, યુલોજીયા હોટેલ નજીક, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧

પૂર્વ તરફઃ ખુલ્લું આકાશ ઉત્તર તરફઃ ખુલ્લું આકાશ પશ્ચિમ તરફ : પેસેજ અને ફ્લેટ નંબર એ પ૦૪ દક્ષિણ તરફ : ફ્લેટ નંબર એ ૫૦૨

બિડની છેલ્લી તારીખ:૨૨-૧૧-૨૦૨૩ બિડ ઓપન કરવાની તારીખઃ ૨૩-૧૧-૨**૦૨**૩

પ્રોપર્ટી જોવા માટેની તારીખ અને સમયઃ ૦૨-૧૧-૨૦૨૩ થી ૨૨-૧૧-૨૦૨૩, સમયઃ સવારે ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી મહેરબાની કરીને નોંધ લેશો કે સરફેસી કાયદાના સેક્શન ૧૩ (૧૩) અન્વયે નોટીસ મળ્યેથી ઈન્ડીયા હોમ લોન લીમીટેડ પાસે રાખેલ અસક્ચામતો પૈકી એક પણ અંગે તમે વેચાણ, લીઝ કે અન્ય કોઈ રીતે વ્યવહાર અમારી પૂર્વમંજુરી સિવાય કરવી નહી.

di. 02-99-2023 સ્થળઃ અમદાવાદ

અધિકૃત અધિકારી,



ડાયરેક્ટર્સ, જામીનદારો અને

ગીરવેદારોના નામ

ઉપરોક્ત હરાજીની તારીખે વેચવામાં

રિકવરી એન્ડ રાઈટ ઓફ ડિપાર્ટમેન્ટ રિજ

THE COSMOS રિકેવરો એન્ડ રાઇટ ઓફ ડિપાર્ટમેન્ટ રિજન-૨ CO-OP. BANK LTD. <u>સંદેશાવ્યવહારનું સરનામું</u> : હોરાઇઝન બિલ્ડીંગ, ૧લો માળ, રાનડે રોડ અને ગોખલે રોડના જંકશન ઉપર, ગોખલે રોડ (ઉત્તર), દાદર (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૨૮. ફોન નં. : ૦૨૨–૨૪૪૭૬૦૧૨/૫૫૭/૫૮

સિક્યોર્ડ મિલકતની વિગતો

બપોરે ૧.૦૦ થી ૨.૦૦

સરફૈસી એક્ટ, ૨૦૦૨ હેઠળ ઈ–હરાજી વેચાણ નોટીસ

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રફ્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર સિક્યોર્ડ મિલકતોના વેચાણ માટે ઇ–હરાજી વેચાણ નોટીસ

આથી ખાસ કરીને દેવાદાર/ગીરવેદાર કંપની , તેના ડાયરેક્ટર, જામીનદારો અને ગીરવેદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો સિક્ચોર્ડ લેણદારને ગીરો કરાચેલ છે, જેનો કબજો ધ કોસ્મોસ કો.ઓપ. બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, જેનું જ્યાં છે, જે છે, જેમ છે ના ધોરણે અને કોઇ આશ્ર્ય વિગર અહીં નીચે આપેલ ટુંકી વિગતો મુજબ બેંકની બાકી રકમની વસુલાત માટે વેચાણ કરવામાં આવશે. દેવાદાર/ગીરવેદાર કંપની, વેચાણ/હરાજી માટે

દેવાદાર/ગીરવેદાર કંપની :-	શીક્ચુલ ૧: ફ્લે	શીક્યુલ ૧: ક્લેટ/યુનિટ નં. ૩/એફ/૪૦૧ (ઔડા ફ્લેટ નં. ૩/સી/૪૦૧ દ્વારા મંજુર કરેલ પ્લાન મુજબ) (શ્રી વિશાલ મહેન્દ્ર વિછ્છીની માલિકીની) અને 📗							
મે. ફાલ્કન ગોલ્ડ હાઉસ પ્રા.લિ.,	ક્લેટ/યુનિટ નં. ૩/એફ/૪૦૨ (ઔડા દ્વારા મંજુર કરેલ પ્લાન મુજબ ફ્લેટ નં. ૩/સી/૪૦૨) (મેસર્સ ફાલ્કન ગોલ્ડ સર્વિસીઝ પ્રા. લીમીટેડની માલિકીની)								
ડાચરેક્ટર/જામીનદાર :	બંને ક્ષેત્રફળ ર	ને ક્ષેત્રફળ આશરે ૨૦૪,૪૬ ચો.મી., ૨૨૦૦ ચો.કુટને સમતુલ્ય (સુપર બિલ્ટ અપ એરિયા ચોથા માળ પરની, હોલો પિંચ ઉપર), ત્રીજો માળ, ઓડા દ્વાર							
શ્રી વિપુલ ગુણવંતરાય વિઠલાણી,	મજુર કરાયલ પ	જુટ કરાચેલ પ્લાન મુજબ, બ્લોક નં. એફ ની (બ્લોક નં. સી, મંજુટ કરાચેલ પ્લાન મુજબ), શ્રી બાલાજી વિંડ પાર્ક સ્કીમની, તેમજ ક્ષેત્રફળ આશરે ૪૭.૩૨ .મી.નો નવહેચાચેલ હિસ્સો ૫૦૯.૨૧ ચો.ક્રૂટને સમતુલ્ય, ફાઇનલ પ્લોટનં.૮૨/૨,ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૩ (ખોરજ), ખાતેની સ્કીમની નજમીનમાં,							
ડાયરેક્ટર/જામીનદાર/ગીરવેદાર :		ગ્રા.મા.ના નવહચાવાલાહસ્સા ૫૦૯.૨૫ વા.કુટન સમતુલ્વ, ફાઇનલ પ્લાટન.૮૨/૨, ટાઇન પ્લાનગ સ્કામ ન. ૬૩(ખારજ), ખાતના સ્કામના નજમાનમાં, ૪ુના રેવન્ચુ સર્વે નં. ૫૧૦ પૈકી, ૫૨૬ પૈકી, ૫૨૯ અને ૫૩૨ પૈકીની બદલીમાં ફાળવાચેલ), મોજે ખોરજ, તાલુકો ગાંધીનગર, ૨ઝુસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ,							
શ્રી વિશાલ મહેન્દ્ર વિછી		ગાંધીનગર અને જિલો ગાંધીનગર, ગુજરાત ખાતેની સ્થાવર મિલકત.							
ડિમાન્ડ નોટીસની તારીખ અને રકમ	કબજાની તારીખ અને સમય	રીઝર્વ કિંમત	અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી)	ઈ-હરાજીની તારીખઅને સમય	બીડ વૃદ્ધિની રકમ	નિરિક્ષણની તારીખ અને સમય			
માંગણા નોટીસની તારીખ: ૧૩.૦૨.૨૦૨૩ રૂા.૩,૦૯,૧૯,૯૨૯.૦૦ વત્તા તેના પરનું ચક્ત વ્યાજ અને ચાર્જિસ	૧૨.૧૦.૨૦૨૩ ભૌતિક	રૂા.૧,૮૦,૦૦,૦૦૦/– (રૂપિયા એક કરોડ એંસી લાખ પુરા)	રૂા. ૧૮,૦૦,૦૦૦/– (રૂપિયા અઢાર લાખ પુરા)	૦૫.૧૨.૨૦૨૩ બપોરે ૧.૦૦ થી ૨.૦૦	રૂા. ૫૦,૦૦૦/– (રૂપિયા પચ્ચાસ હજાર પુરા)	૧૮.૧૧.૨૦૨૩ સવારે ૧૧.૦૦ થી બપોરે ૪.૦૦			
સ્ટેચ્યુટરી નોટીસ: સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) મુજબ	શીક્યુલ ૨: ફ્લેટ/યુનિટ નં. 3/એફ ૯૦૩(ઐડિ. દ્વારા મંજુર કરાયેલ પ્લાન મુજબ ફ્લેટ નં. 3/સી/૯૦૩) અને ફ્લેટ/યુનિટ નં. 3/એફ/૯૦૪ (ઐડિ. દ્વારા મંજુર કરાયેલ પ્લાન મુજબ ફ્લેટ નં. 3/સી//૯૦૪) (બંને ફ્લેટ મેસર્સ ફાલ્કન ગોલ્ડ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડની માલિકીના), બંનેનું ક્ષેત્રફળ ા આશરે ૨૦૪.૪૬ ચો.મી., ૨૨૦૦ ચો.ક્ટુટને સમતુલ્ય (સુપર બિલ્ટ અપ એરિયા ચોથા માળ પરની, હોલો પિંચ ઉપર), ત્રીજો માળ, ઓડા દ્વાર મંજુર કરાયેલ								
આ નોટીસ જણાવેલ લોનના	પલાન મુજબ, બ્લોક નં. એફ ની (બ્લોક નં. સી, મંજુર કરાયેલ પલાન મુજબ), શ્રી બાલાજી વિંડ પાર્ક સ્કીમની, તેમજ ક્ષેત્રફળ આશરે ૪૭.૩૨ ચો.મી.નો નવહેચાયેલ હિસ્સો ૫૦૯.૨૧ ચો.કૂટને સમતુલ્ય, ફાઇનલ પ્લોટનં. ૮૨/૨, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. દ્દ3 (ખોરજ), ખાતેની સ્કીમની નજમીનમાં, જુના								
દેવાદાર/ગીરવેદાર કંપની, તેના									
ડાયરેક્ટર, જામીનદારો અને	રેવન્યુ સર્વે નં. ૫૧૦ પૈકી, ૫૨૬ પૈકી, ૫૨૯ અને ૫૩૨ પૈકીની બદલીમાં ફાળવાચેલ), મોજે ખોરજ, તાલુકો ગાંધીનગર, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ,								
ગીરવેદારો મારફતને વેચાણની તારીખ	ારીખ ાાંદીનગર અને જિલો ગાંદીનગર, ગુજરાત ખાતેની સ્થાવર મિલકત.								
પહેલા પુરેપુરી રક ચુકવવા ૩૦ દિવસીચ	કબજાની તારીખ	રીઝર્વ કિંમત	અર્નેસ્ટ મની	ઈ-હરાજીની તારીખ અને	બીડ વૃદ્ધિની રકમ	નિરિક્ષણની તારીખ અને			
નોટીસ આપવામાં આવે છે, જેમાં	અને પ્રકાર		ડિપોઝીટ (ઈએમડી)	સમય	-	સમય			
નિષ્ફળ જતાં સિક્યોર્ડ મિલકતો	92.90.2023	રૂા. ૧,૮૦,૦૦,૦૦૦/–	રૂા. ૧૮,૦૦,૦૦૦/–	o4.92.2023	રૂા. ૫૦,૦૦૦/–	9८.99.२०२३			

આવશે નોંધ: ૧. ઈએમડી ફોર્મ અધિકૃત અધિકારી પાસે ઉપલબ્ધ છે. ૨. છએમડી ચુકવણી માટે અધિકૃત અધિકારીનો સંપર્ક કરવો. અને ૩) છએમડી અને કેવાયસી દસ્તાવેજો જમા કરવાની છેલી તારીખ અને સમય: ૦૪.૧૨.૨૦૨૩ ના રોજ ૪.૩૦ વાગ્યે ઈ–હરાજીની વિગતવાર શરતો અને નિયમો માટે બેંક વેબસાઇટ એટલે કે https://www.cosmosbank.com/auction-notice.aspx અને ઓક્શનર વેબસાઇટ એટલે કે

(રૂપિયા એક કરોડ એંસી લાખ

https://cosmosbank.auctiontiger.net ઉપર ઉપલબ્ધ છે.

(રૂપિયા અઢાર લાપ

અધિકૃત અધિકારી તારીખ: ૦૨.૧૧.૨૦૨૩ સરફૈસી એક્ટ, ૨૦૦૨ હેઠળ

સ્થળ: મુંબઇ

દ્ય કોસ્મોસ કો–ઓપરેટીવી બેંક લીમીટેડ

સવારે ૧૧.૦૦ થી બપોરે

(રૂપિયા પચ્ચાસ હજાર પુરા)

ઈન્ડીયા હોમ લોન લીમીટેડ

Quarter Half Year Quarter

Sr No		Ended September 30, 2023	Ended September 30, 2023	Ended September 30, 2022
		Unaudited	Unaudited	Unaudited
1	Revenue from Operations	12,267.15	25,195.23	14,150.03
2	Net (Loss) / Profit for the period before taxes and before Share in profit/(loss) of Associates and Joint Ventures (before Exceptional and/or Extraordinary items)	(108.25)	(175.93)	59.58
3	Net (Loss) / Profit for the period before taxes and before Share in profit/(loss) of Associates and Joint Ventures (after Exceptional and/or Extraordinary items)	(161.76)	(229.44)	59.58
4	Net (Loss) / Profit for the period after taxes and before Share in profit/(loss) of Associates and Joint Ventures (after Exceptional and/or Extraordinary items)	(130.23)	(189.94)	31.87
5	Net (Loss) / Profit for the period after taxes and after Share in profit/(loss) of Associates and Joint Ventures (after Exceptional and/or Extraordinary items)	(130.73)	(209.65)	48.76
6	Total Comprehensive (Loss) / Income for the period [Comprising of (Loss) / Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(132.25)	(210.17)	39.02
7	Paid-Up Equity Share Capital (Face Value of ₹ 1 Each)	129.97	129.97	129.97
8	Earnings Per Share (Face Value of ₹1 Each) Basic and Diluted (in ₹) (Not Annualised for the quarter and six months)	(1.01)	(1.61)	0.38

Notes: The aforesaid consolidated financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on October 31, 2023 and Novembe 01, 2023 respectively.

Z Additional information on Standardie Financial Results is as follows:					
Particulars	Quarter Ended September 30, 2023	Half Year Ended September 30, 2023	Quarter Ended September 30, 2022		
	Unaudited	Unaudited	Unaudited		
Revenue from Operations	11,719.72	24,098.55	13,409.92		
(Loss) / Profit Before Tax	(114.54)	(163.75)	84.98		
(Loss) / Profit After Tax	(87.05)	(125.49)	62.15		
	Particulars Revenue from Operations (Loss) / Profit Before Tax	Particulars Particulars Quarter Ended September 30, 2023 Unaudited Revenue from Operations 11,719.72 (Loss) / Profit Before Tax (114.54)	Particulars Quarter Ended September 30, 2023 Half Year Ended September 30, 2023 Wind the Work of the Sevenue from Operations 11,719.72 24,098.55 (Loss) / Profit Before Tax (114.54) (163.75)		

The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the quarter and half year ended on September 30, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter and half year ended on September 30, 2023 are available on the Stock Exchange websites (www.nseindia.com/www.bseindia.com) and Company's website www.adaniwilmar.com. For and on behalf of the Board of Directors

Place: Ahmedabad Date: November 01, 2023

Angshu Mallick Managing Director and Chief Executive Officer

Adfactors 38:

Place: Ahmedabad

ARVIND SMARTSPACES LIMITED VIND

Earnings Per Share (of ₹ 10/- each)

SMARTSPACES

[CIN - L45201GJ2008PLC055771]

Basic: (₹)

Diluted: (₹)

Regd. Office: 24, Government Servant's Society, Near Municipal Market, Off. C.G. Road, Navrangpura, Ahmedabad-380009. Contact: 079 6826 7000 Website: www.arvindsmartspaces.com Email: investor@arvindinfra.com

1.77

1.76

1.13

1.10

3.68

3.65

2.83

2.78

5.83

5.63

[₹ in Lakhs except per share data] Half year ended on Sr **Particulars** Quarter ended on Year ended No. 30.09.2023 30.06.2023 30.09.2022 30.09.2023 30.09.2022 31.03.2023 Audited Unaudited Unaudited Unaudited Unaudited Unaudited 5,033.93 13950.53 11,060.11 25591.68 Revenue from Operations 7266.92 6683.61 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional 1588.78 1309.11 779.12 2897.89 1,812.89 3957.71 and/or Extraordinary items) 1588.78 1309.11 779.12 1,812.89 3957.71 Net Profit / (Loss) for the period before tax (after Exceptional 2897.89 and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional 1083.17 910.04 489.29 1993.21 1,228.60 2782.71 and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising 1078.92 905.79 489.59 1984.71 1229.18 2765.70 Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 4531.20 4531.20 4.396.21 4531.20 4.396.21 Equity Share Capital (Face Value ₹ 10/- per share) 4531.20 6 42109.97 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year

EXTERACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2023

Notes: (1) These unaudited consolidated financial results of Arvind SmartSpaces Limited ("Holding Company") and its subsidiaries (together referred as "Group") and joint ventures for the quarter and half year ended 30th September, 2023 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on 1st November, 2023. The consolidated financial results are prepared in accordance with the Indian Accounting Standard (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013. (2) The Group's business falls within single business segment of developing of commercial and residential units. Hence, disclosures under Ind AS 108- Operating Segments are not reported separately. (3) Previous period figures have been regrouped, rearranged and reclassified where necessary to conform to current period's classification.

1.91

1.89

The standalone financial results for the quarter and half year ended 30th September, 2023 are summarised below: [₹ in Lakhs] Half year ended on Year ended No. 30.09.2023 30.06.2023 30.09.2022 30.09.2023 30.09.2022 31.03.2023 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Revenue from operations 4269.64 3233.53 2875.03 7503.17 5645.23 11727.81 2 Profit before tax 2328.12 1479.32 1299.38 3807.44 2768.69 4734.41 2105.80 1221.03 1043.30 3326.83 3827.31

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended on 30th September, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the standalone and consolidated financial results are available on the Stock Exchange websites at <u>www.bseindia.com</u> and <u>www.nseindia.com</u> and on the company's website <u>www.arvindsmartspaces.com</u>.

For, Arvind SmartSpaces Limited Date: 1st November, 2023 Kamal Singal

Managing Director and CEO